

: વાંચ્યા :

- (૧) અરજદારશ્રી પટેલ વિનુભાઈ જીવાભાઈ વિગેરે રહે. C/o સી-૫૯, દીપીકા સોસાયટી, કારેલીબાગ, વડોદરાની મોજે હરણી તા. વડોદરાના સ. નં. ૬૬, ટી. પી. નં. ૧, ફા. પ્લોટ નં. ૩૫ ની ૩૯૬૬ ચો. મી. જમીનની રહેણાંકનાં હેતુ માટે બીનખેતીની પરવાનગી મળવાની તા. ૧૪/૦૨/૧૧ ની અરજી.
- (૨) મામલતદારશ્રી વડોદરા શહેરનાં પત્ર નં. જમીન/૫૩/૧૬૩૧/૧૧, તા. ૨૨/૦૩/૧૧ થી આવેલ દરખાસ્તનાં કાગળો
- (૩) નગર નિયોજકશ્રી, શહેરી વિકાસ સત્તામંડળ, વડોદરાના ઝોન સર્ટીફિકેટ નં. પત્ર નં. યુડીએ/ઝોન સર્ટી/૨૭૬૮/૧૦, તા. ૨૩/૦૮/૧૦
- (૪) નગર નિયોજકશ્રી, શહેરી વિકાસ સત્તામંડળ, વડોદરાના પત્ર નં. યુડીએ/પ્લાન-૨/૧૬૩/૧૧ તા. ૦૪/૦૩/૧૧ થી આવેલ અભિપ્રાય
- (૫) ખાસ જમીન સંપાદન અધિકારીશ્રીઓને અત્રેથી તા. ૧૭/૦૨/૧૧ ના રોજ ઈસ્યુ કરેલ નોટીસ તથા રજુ થયેલ અભિપ્રાય.
- (૬) જમીન મહેસુલ કાયદાની કલમ-૬૫
- (૭) જમીન મહેસુલ નિયમોનાં નિયમ-૮૧(૨)
- (૮) ગુજરાત સરકાર, મહેસુલ વિભાગના, ઇચાર ક્રમાંક: બાપ/૧૦૦૬/૪૨૫/૩, તારીખ: ૧-૭-૨૦૦૮



મોજે હરણી તા. વડોદરાના નીચે જણાવેલ સર્વે નંબર વાળી ખેતીની જમીન (૧) શ્રી પટેલ વિનુભાઈ જીવાભાઈ (૨) શ્રી પટેલ મંજુલાબેન વિનુભાઈની સહવા પત્ની (૩) શ્રી પટેલ સીરાલી વિનુભાઈ (૪) શ્રી પટેલ અનીશ વિનુભાઈ (૫) શ્રી પટેલ જેનીતા વિનુભાઈ (૬) શ્રી પટેલ પુનીતાબેન વિનુભાઈ (૭) શ્રી પટેલ મયુર વિનુભાઈ (૮) શ્રી પટેલ સંદિપકુમાર વિનુભાઈનાં સંયુક્ત ખાતે ચાલે છે.

સર્વે નંબર	ટી. પી. નંબર	ફા. પ્લોટ નંબર	ક્ષેત્રફળ (ચો. મી.)
૬૬	૧	૩૫	૩૯૬૬



- (૨) માલિકી હકકપણા (ટાઈટલ) બરાબર હોવાનું તથા યુએલશી કાયદા હેઠળ જમીન કાજલ થયેલ નથી તેમજ સરકાર હસ્તક કબજો લેવાયેલ નથી તેમજ કબજો અરજદાર પાસે છે તથા જમીનના માલિકીપણા અંગે કેસ, વિવાદ કે અપીલ ચાલુમાં નથી તેમજ જમીનમાં કોઈ સરકારી લેણું વસુલ લેવાનું બાકીમાં નથી તેમ મામલતદારશ્રીએ જણાવેલ છે.
- (૩) સવાલવાળી જમીન જુની શરતની છે. એમ મામલતદારશ્રીએ જણાવેલ છે.
- (૪) સવાલવાળી જમીન અંગે વુડા કચેરીનું વંચાણ-૪ થી જરૂરી મુ. દિ. પુ. વિ. યોજનાનું ઝોન સર્ટી. રજુ થયેલ છે. જે જોતાં સવાલવાળી જમીન રહેણાંક ઝોન (આર-૧) તથા સ્થાનિક વાણિજ્ય ઝોનમાં આવે છે.
- (૫) નગર નિયોજકશ્રી શહેરી વિકાસ સત્તા મંડળ વડોદરાના વંચાણ-૪ ના પત્ર મુજબ સવાલવાળી જમીન હાલ અમલી/મંજુર યોજના મુજબ રહેણાંક ઝોન તથા સ્થાનિક વાણિજ્ય ઝોનમાં આવે છે. તથા મુ. દિ. પુ. વિ. યોજનામાં રહેણાંક ઝોન (આર-૧) તથા સ્થાનિક વાણિજ્ય ઝોનમાં આવે છે જેથી રહેણાંક હેતુ માટે પરવાનગી આપવામાં આવે તો ઝોનની દૃષ્ટિએ વાંધા સરખું નથી તેમ હકારાત્મક અભિપ્રાય આવેલ છે.
- (૬) સંપાદન અધિકારીશ્રીઓએ વંચાણ-૬ થી આ જમીન સંપાદનની કાર્યવાહી હેઠળ નથી એવું જણાવેલ છે.

23

- (ક) મામલતદારશ્રીએ તપાસ કરતાં આ જમીન ઉપર બિનપરવાનગીનું બાંધકામ કે બિનખેતીનો ઉપયોગ થયો નથી, અરજદારે પરવાનગી આપતાં કરાવવામાં આવે તે શરતો મુજબ ચર્ચવા તથા કરાવે તે વિ.ધારો ભરવા સંમતિ જાપાબ આપેલી છે. તથા રહેણાંક હેતુ ૬૨ ચો.મી. રૂ. ૦-૨૫ પૈસા પ્રમાણે તથા પ્રવર્તમાન દરે લોકલેન્ડ તથા શિક્ષણ ઉપકર અને રૂપાંતરકર ભરવાની શરતે બિનખેતી પરવાનગી આપવા ભલામણ કરેલ છે.
- (ગ) ખાતેદારે રહેણાંકના ૬૨ ચો.મીટરે રૂ. ૧૦/- પ્રમાણે ૩૯૬૬ ચો.મી. જમીનના રૂપાંતરકરની રકમ રૂ. ૩૯,૬૬૦/- (અંકે રૂપિયા ઓગણ ચાલીસ હજાર છસો સાઈક પુરા) તા. ૧૯/૦૫/૧૧ ના રોજ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં "૦૦૩૫" સદરે જમા કરાવી અસલ ચલન રજૂ કરેલ છે. તેમજ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં માપણી ફીની રકમ રૂ. ૧,૨૦૦/- તા. ૧૯/૦૫/૧૧ ના રોજ જમા કરાવી પહોંચ રજૂ કરેલ છે.
- (દ) સબબ, મોજે હરણી તા. વડોદરાના નીચે જણાવેલ સર્વે નંબર વાળી જમીનના

સર્વે નંબર	ટી.પી. નંબર	ફા.પ્લોટ નંબર	ક્ષેત્રફળ (ચો.મી.)
૬૬	૧	૩૫	૩૯૬૬

રહેણાંકના રૂ. ૦-૨૫ પૈસા પ્રમાણે પત્રકમાં જણાવ્યા પ્રમાણે વિશેષધારો તથા અન્ય ઉપકરો પ્રવર્તમાન દરે તા. ૧/૮/૨૦૦૯ થી બીજો હુકમ થતાં સુધી દર વર્ષે ભરવાની તથા સક્ષમ સત્તાધિકારીશ્રી પાસેથી મંજૂર કરેલા નકશા તથા રજાચિટ્ટી મેળવી બાંધકામ કરવાની શરતે બિનખેતીના રહેણાંકનાં હેતુ માટે પરવાનગી આપવા નીચેની વધુ શરતોને આધીન હુકમ કરવામાં આવે છે.

પરિશિષ્ટ-૪

બિનખેતી પરવાનગી મેળવવા ઈચ્છતા અરજદારે પાલન કરવાની શરતો :

(બિનખેતી પરવાનગી આપનાર સક્ષમ સત્તાએ આ પરિશિષ્ટ બિનખેતીની પરવાનગી આપતા હુકમ સાથે અંગૂઠા રાખવાનું રહેશે.)

- (૧) ડીસ્ટ્રીક્ટ ઈન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકૉર્ડ્સ વ્હારા ઈસ્યુ કરાયેલ માપણી શીટ કે જેના ઉપર મૂળ ટ્રેસિંગની હદ પણ દર્શાવેલ હોવી જોઈએ. રજૂ કરાયેલ પ્લાન તથા લે-આઉટ પ્લાન સક્ષમ કક્ષાએ મંજૂર કરાયેલ હોવો જોઈશે.
- (૨) બાંધકામ શરૂ કરતાં પહેલા બાંધકામના નકશા સક્ષમ અધિકારી પાસે મંજૂર કરાવવાના રહેશે, પરંતુ અરજદાર બિનખેતી પરવાનગી મેળવ્યા વગર આવા બાંધકામની રજા ચીટ્ટી મેળવી શકશે નહીં.
- (૩) સહેરી વિસ્તાર જ્યાં ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થઈ ગઈ છે ત્યાં જી.ડી.સી. આર. અને ઝોનીંગના નિયમો અનુસાર બાંધકામ કરવાનું રહેશે.
- (૪) મંજૂર થયેલ નકશા મુજબ આરોગ્ય અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગંદા પાણીના નિકાલની જોગવાઈ કરવાની રહેશે.
- (૫) અરજદારે રીબિન ડેવલપમેન્ટ ડેલ્સ નીચે જે તે રસ્તાનો પ્રકાર ધ્યાને લઈ રસ્તાના મધ્યબિંદુથી બાંધકામ વચ્ચે અંતર જાળવવાનું રહેશે અન્યથા અરજદારની જવાબદારી થશે.
- (૬) ઔદ્યોગિક હેતુ માટે મંજૂરી માંગેલ હોય તો બાંધકામ કરતાં પહેલા જિલ્લા ઉદ્યોગ અધિકારીની જરૂરી મંજૂરી મેળવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવાની રહેશે.
- (૭) સવાલવાળી જમીન જો જેલથી નજીક હોય તો ૧૮૪ મીટરનું અંતર છોડી બાંધકામ કરવાનું રહેશે.
- (૮) સવાલવાળી જમીન જો રેલ્વે હદની નજીક હોય તો રેલ્વેની હદથી ૩૦ મીટર જગ્યા છોડી બાંધકામ કરવાનું રહેશે.
- (૯) સવાલવાળી જમીન ઉપરથી અથવા બાજુમાંથી વિજળી-ગ્રીડના તાર/ હાઈટેન્શન પાવર અગર ચાંબલા આવેલ હોય ત્યારે તે અન્વયે લાગુ પડતા નિયમોનું પાલન કરવા અને તે મુજબ બાંધકામ કરવાનું રહેશે.
- (૧૦) બિનખેતી માંગવામાં આવી હોય તેવી જમીન જો એરોડ્રામ આસપાસના ૨૦ કી.મી.ની ત્રિજ્યામાં આવતી હોય ત્યારે બાંધકામની ઉંચાઈ તથા એરોડ્રામની દ્રષ્ટિએ જરૂરી એવું 'ના વાંધા પ્રમાણપત્ર' સીવીલ એવીએશન ખાતા પાસેથી મેળવવાનું રહેશે અને સીવીલ એવીએશન ખાતાના નિયમોનું પાલન કરવાનું રહેશે.
- (૧૧) ભારતીય વાયુસેનાના હવાઈ મથક તથા ઈન્સ્ટોલેશનથી ૯૦૦ મીટરની ત્રિજ્યા બહાર બાંધકામ કરવાનું રહેશે.



(૧૨) ઓ.એન.જી.સી.ના કુલ નજીકમાં આવેલ જમીનના કિસ્સામાં અરજદારે સંબંધિત નિયમોનું પાલન કરવાનું રહેશે.

(૧૩) નર્મદા કેનાલ/અન્ય ક્ષિતિય કેનાલની નજીકમાં આવેલ જમીનની બાબતમાં અરજદારે સુચિત બાંધકામ માટે જાળવવાના થતાં અંતર ભંગના નિયમોનું પાલન કરવાનું રહેશે.

(૧૪) અરજદારે/જ્યાં જરૂરી હોય ત્યાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના કાયદા નીચે રક્ષિત સ્મારક (PROTECTED MONUMENTS) તરીકે જાહેર કરેલ પ્રાચીન સ્મારકથી ૧૦૦ મીટર સુધીનું અંતર જાળવવાની પ્રવર્તમાન જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.

(૧૫) અરજદારે/જ્યાં જરૂરી હોય ત્યાં ભારતીય વન અધિનિયમ હેઠળ અનામત વન જમીન કે રક્ષિત વન તરીકે જાહેર કરેલ વન/જમીનથી જાળવવાના થતાં અંતર બાબતની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.

(૧૬) અરજદારે/જ્યાં જરૂરી હોય ત્યાં વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ અન્વયે અભ્યારણ્ય અથવા રાષ્ટ્રીય ઉપવન તરીકે જાહેર કરેલ કોઈપણ વિસ્તારની હદથી જાળવવાના થતાં અંતર બાબતની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.

અરજદારે ઉપરોક્ત સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો તેમાં નિષ્ફળ જશે તો, શરતભંગ ગણી સક્ષમ અધિકારી કાયદેસરની કાર્યવાહી કરશે.

વધુમાં અરજદારશ્રીએ નીચેની શરતોનું પણ પાલન કરવાનું રહેશે.

(૧૦) બાંધકામ શરૂ કર્યા તારીખથી એક માસમાં અને બાંધકામ પૂરું કર્યા તારીખથી એક માસમાં એમ બન્ને પ્રસંગોએ અગ્રે લેખિતમાં જાણ કરવી પડશે.

(૧૮) આ જમીન ઉપરનું મંજૂર થયા પ્રમાણે બાંધકામ આ હુકમ થયા તારીખથી છ માસમાં શરૂ કરી ત્રણ વર્ષમાં પૂરું કરવાનું રહેશે. તેમ કરવામાં ચુક થયે કલમ-૬૭ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. અને વસુલ ભરેલો વિ.ધારા વિગેરે કોઈપણ સંજોગોમાં પરત મેળવવાનો હકક રહેશે નહિ. આ અંગે અપીલનો સમય પૂરા થયા બાદ કોઈ હકક રહેશે નહિ.

(૧૯) રજાચિઠિ, લેઆઉટ પ્લાન વિરુદ્ધ બાંધકામ થવાનાં પ્રસંગે કલેક્ટરશ્રી હુકમ કરે તે સમયમાં દૂર કરવાનું રહેશે. અને તે વિરુદ્ધ વર્તન થવાનાં પ્રસંગે કબજેદારને ખર્ચે દૂર કરાવવામાં અને ખર્ચ જમીન મહેસુલ બાકી રાહે વસુલ કરવામાં થશે. અને કલેક્ટરશ્રી ઠરાવે તે દંડ ભરવો પડશે.

હુકમ થયા તારીખથી છ માસની અંદર કબજેદારે જમીન મહેસુલ કાયદામાં જણાવ્યા મુજબ નમુના "એમ" માં સનદ ભરી આપવાની રહેશે. તે વિરુદ્ધ વર્તન થવાનાં પ્રસંગે કલેક્ટરશ્રી ઠરાવે તે દંડ ભરવાનો રહેશે. ઉક્ત સનદ અપીલનો સમય પૂરો થયા બાદ ભરી આપવાની રહેશે.

(૨૧) જે હેતુનું બાંધકામ પુરું થયેથી એક માસની અંદર તેની જાણ પરવાનગી આપનાર અધિકારીને કબજેદારે કરવાની રહેશે.

(૨૨) " વરસાદી પાણીના ભૂગર્ભ વહન/સંચય માટે દર મકાન /બહુમાળી મકાન (નકશા મંજૂર કરવાની સત્તા ધરાવતા સત્તાતંત્રએ આપેલ મંજૂરી મુજબ) દીઠ એકના દરે પરકોલેટીંગ બોરની વ્યવસ્થા અચૂક કરવાની રહેશે. "

(૨૩) જમીન ધારકશ્રીએ સક્ષમ સત્તાધિકારીશ્રી તરફથી મંજૂર થયેલ સુચિત નકશા મુજબ/ રજાચિઠિ મુજબ બાંધકામ કરવાનું રહેશે. તથા મંજૂર થયેલ રજાચિઠિ તથા નકશાની એક નકલ દિન-૩૦માં રજુ કરવાની રહેશે.

(૨૪) તેમજ હુકાના જી.ડી.સી.આર ના જોનીંગ રેગ્યુલેશન મુજબ બાંધકામની પરવાનગી મેળવ્યા બાદ જ અરજદારે બાંધકામ શરૂ કરવાનું રહેશે.

(૨૫) આ જમીનની જે હેતુ માટે પરવાનગી આપી છે તે હેતુ સિવાય અન્ય હેતુ માટે ઉપયોગ કરતાં પહેલાં કલેક્ટરશ્રીની પરવાનગી લેવાની રહેશે. તે વિરુદ્ધ વર્તન થવાના પ્રસંગે લે.રે.કોડની કલમ-૬૬ મુજબ પગલાં લેવામાં આવશે.

(૨૬) આ હુકમથી સામેલ પરવાનગીના સમયે જે નકશા મંજૂર થયેલા હોઈ અને તેમાં જે કોમન પ્લોટની જગ્યા નક્કી કરવામાં આવેલ હોય તે કોમન પ્લોટની જગ્યા કલેક્ટરશ્રીની પુર્વ મંજૂરી સિવાય તબદીલ કે વેચાણ કરી શકાશે નહીં.

(૨૭) આ જમીનનો વિશેષધારો રહેણાંકના કામે ૩૯૬૬ ચો.મી. નો દર ચો.મી.નાં રૂા.૦-૨૫ પૈસા પ્રમાણે રૂા.૯૯૨/- તા.૧/૮/૨૦૦૯ થી બીજો હુકમ થતાં સુધી દર વર્ષે પ્રવર્તમાન દરે તથા લોકલ ફંડ રૂા.૪૯૬/- તથા શિશુલ ઉપકર રૂા.૨૪૮/- વિશેષધારો ઉપરાંત ભરવાનો રહેશે. તે અંગે કોઠારૂપે પત્રક સામેલ છે તે મુજબ અમલ કરવાનો રહેશે.



(૨૮) ઉપરની કોઈપણ શરત અગર સનદમાં જણાવેલી શરતો પૈકી કોઈપણ શરતનો ભંગ થયા પ્રસંગે જમીન મહેસુલ કાયદામાં જણાવેલી શિવાને કમજોદાર પાત્ર અને તેનો બાધ લીધા સિવાય કલેક્ટરશ્રી જે પગલાં લેશે તે કમજોદારને બંધનકર્તા રહેશે.

૬૨૧.

રવાના કુરુ
મામલતદાર(બિનખેતી)
કલેક્ટર કચેરી, વડોદરા



સહી/-
(વિજય નેહરા)
કલેક્ટર વડોદરા

રજી.પોસ્ટ એડી.બી
પ્રતિ,

- (૧) શ્રી પટેલ વિનુભાઈ જીવાભાઈ
 - (૨) શ્રી પટેલ મંજુલાબેન વિનુભાઈની સઘવા પત્ની
 - (૩) શ્રી પટેલ સીરાલી વિનુભાઈ
 - (૪) શ્રી પટેલ અનીશા વિનુભાઈ
 - (૫) શ્રી પટેલ જેનીતા વિનુભાઈ
 - (૬) શ્રી પટેલ પુનીતાબેન વિનુભાઈ
 - (૭) શ્રી પટેલ મયુર વિનુભાઈ
 - (૮) શ્રી પટેલ સંદિપકુમાર વિનુભાઈ
- સી-૫૯, દીપીકા સોસાયટી,
કારેલીબાગ,
વડોદરા.

નકલ જપ ભારત સહ રવાના :-

- (૧) મ્યુનિસિપલ કમિશનરશ્રી, (બાંધકામ શાખા), વડોદરા મહાનગર સેવા સદન, ખંડેરાવ માર્કેટ, વડોદરા તરફ
- (૨) નગર નિયંત્રકશ્રી, વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ (ગુડ), એલ એન્ડ ટી. સર્કલ નજીક, વી.આઈ.બી. રોડ, ગુડા ભવન, કારેલીબાગ, વડોદરા તરફ.
- (૩) મામલતદારશ્રી વડોદરા શહેર તરફ (હુકમની નકલ બે પ્રતમાં)
એક પ્રત તાલુકા નમુના નં. ૪ માં ઉપજની નોંધ કરાવી ગામ દફતરે રાખવા મોકલવા તથા વિ.ધારાની રકમ સને ૨૦૦૯-૨૦૧૦ નાં હિસાબોમાં સાધવા તથા ગામે તા.ન.નં. ૨ તથા ૭/૧૨માં વિ.ધારાની નોંધ કરાવવા અને નિયમ પ્રમાણે આગળની તજવીજ કરવા સારુ.
- (૪) જિલ્લાં નિરીક્ષકશ્રી, જમીન દફતર વડોદરા
- (૫) સીટી સર્વે સુપ્રિ. શ્રી નં. ૩, વડોદરા તરફ (કામના કાગળો સહ)
૨/-જરૂરી કાર્યવાહી થવા સારુ
- (૬) સર્કલ ઓફિસરશ્રી / સર્વેયરશ્રી, બિનખેતી શાખા, કલેક્ટર કચેરી, વડોદરા તરફ.
- (૭) બિનખેતી શાખા, કલેક્ટર કચેરીના કલમ-૬૬ દફતર તરફ
- (૮) નાયબ નગર આયોજન અધિકારીશ્રી, નર્મદા ભુવન વડોદરા તરફ.
- (૯) જન સેવા કેન્દ્ર, કલેક્ટર કચેરી, વડોદરા તરફ જરૂરી કાર્યવાહી કરવા સારુ.

(BAR CODE NO. VDR 310420)



TRUE COPY

Nagin S. Gohil
NOTARY, VADODARA

માનજતાના પરવાનગા માંગેલ
જમીનનો સ.નં., સોત્રકળ તથા
કબજેદારનું નામ

તીની				નિયમ મુજબ		વસુલ કરવાની		રૂપાત લેવાની		લોકલ કંડની		શિક્ષણ		કબજેદારની	
પરવાનગી માંગેલ જમીનનું સોત્રકળ				લેવાનો વિશેષ ધારાના રકમ		વિશેષ ધારાની રકમ		વિગત (૧૦/- પ્રતિ ચો.મી.)		(૦.૫૦ ચો. વિ. ધારાના)		ઉપકરની રકમ (૦.૨૫ ચો. વિ. ધારાના)		કબજેદારની	
૨				૩		૪		૫		૬		૭		૮	
ચો.મી. ૩૮૬૬ (રહેણાંક)				(રહેણાંક) ના લેણાદરે દર ચો.મી. ના ૦.૨૫ ચૈસા પ્રમાણે		ચૈસા ૮૮૨/- (અંકે રૂપિયા નવસો બાવું પુરા)		ચૈસા ૩૮,૬૫૦/- (અંકે રૂપિયા અગ્રણ ચાલીસ હજાર છસો સાઈઠ પુરા)		ચૈસા ૪૮૬/- (અંકે રૂપિયા ચારસો છપ્પું પુરા)		ચૈસા ૨૪૮/- (અંકે રૂપિયા બસો અડતાલીસ પુરા)		તા. ૧-૮-૨૦૦૮ થી પ્રવર્તમાન હરે જે વધુ હોય તે	
કબજેદારશ્રી :-				(૧) શ્રી પટેલ વિનુભાઈ જીવાભાઈ		(૨) શ્રી પટેલ મંજુલાબેન વિનુભાઈની સંધવા પત્ની		(૩) શ્રી પટેલ સીરાલી વિનુભાઈ		(૪) શ્રી પટેલ અનીશા વિનુભાઈ		(૫) શ્રી પટેલ જેનીતા વિનુભાઈ		(૬) શ્રી પટેલ પુનીતાબેન વિનુભાઈ	
				(૭) શ્રી પટેલ મયુર વિનુભાઈ		(૮) શ્રી પટેલ સંદિપકુમાર વિનુભાઈ									

નોંધ :- રૂપાંતરકરની રકમ રૂ. ૩૮,૬૫૦/- (અંકે રૂપિયા અગ્રણ ચાલીસ હજાર છસો સાઈઠ પુરા) તા. ૧૮/૦૫/૧૧ ના રાજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં "૦૦૩૫" સંદર્ભે જમા કરાવી અસલ ચલન રજુ કરેલ છે.

રવાના કરું

મામલતફીર (વિનયેતી)
કલેક્ટર કચેરી, વડોદરા



સહી/-
(વિજય નેહરા)
કલેક્ટર વડોદરા

TRUE COPY
Nagim S. Gohil
NOTARY, VADODRA